

પરિશિષ્ટ C- નિવારક પગલાં

ચૂંટણી પ્રક્રિયાના સંભવિત વિક્ષેપોને ટાળવા માટે મતદારોના રજિસ્ટ્રાર (ROV) પાસે લેવા માટે નીચેના નિવારક પગલાં છે:

માનક સુરક્ષા પગલાં

ચૂંટણી સંબંધિત સામગ્રી અને સાધનોની એક્સેસને મર્યાદિત કરવી અને અંતે કોઈપણ સંભવિત વિક્ષેપોને રોકવા:

- સ્ટાફ દ્વારા કાઉન્ટી અથવા વિભાગે જારી કરેલા ID બેજ પહેરવા જરૂરી છે.
- મુલાકાતીઓ અથવા બિન-કર્મચારીઓ જેઓ આગળના ડેસ્ક સિવાય વિભાગની ઓફિસોમાં પ્રવેશ કરે છે મુલાકાતી જેને મળવા આવ્યા હોય તે કર્મચારી સાથે હોવા આવશ્યક છે.
- વિભાગના કમ્પ્યુટર સર્વર રૂમ અને મતપત્ર રૂમ હંમેશા મર્યાદિત બેજ એક્સેસ સાથે અને વિડિઓ સર્વેલન્સ દ્વારા સુરક્ષિત હોય.

સર્વર અને નેટવર્ક બેકઅપ

મુખ્ય સર્વર અથવા નેટવર્ક બંધ પડવાની ઘટનામાં માહિતી પ્રવાહનો વિક્ષેપ રોકવા:

- વિભાગની મતદાન પ્રણાલી, મતપત્ર લેઆઉટ અને ડિઝાઇન, અને ચૂંટણી મેનેજમેન્ટ સિસ્ટમ (EMS) પ્રવૃત્તિ કાઉન્ટીના સુરક્ષિત ડેટા કેન્દ્ર પર સ્થિત રહેશે.
- આ ડેટાના બેકઅપ્સ આપમેળે થાય છે અને મુખ્ય સર્વર ડાઉન જાય તો કાર્યરત થવા માટે તૈયાર રાખવામા આવે છે.
- મતદારોના ડેટા, મતદાન પ્રણાલી અને EMS માં થયેલા ફેરફારોનો નિયમિત અનુસૂચિત બેકઅપ લેવામાં આવે છે.

મત કેન્દ્ર ઉપકરણોનો બેકઅપ સેટ

કોઈપણ ઉપકરણો બિનઉપયોગી થઈ જાય તો મતદાન પ્રક્રિયામાં વિક્ષેપને રોકવા માટે:

- જો કોઈ મત કેન્દ્ર ખાતે કોઈ એવી ઘટના બને છે જેમાં તેના વર્તમાન ઉપકરણો બિનઉપયોગી થાય છે, તો વિભાગ પાસે વધારાના ઉપકરણો ઉપલબ્ધ હોવા જોઈએ જેથી મતદાન સ્થાન પર મતદારોની કાર્યવાહી ચાલુ રહી શકે.
- જો ત્યાં કોઈ વધારાના ઉપકરણો ઉપલબ્ધ ન હોય, તો મત કેન્દ્ર પર મેન્યુઅલ પ્રક્રિયા હેઠળ સંચાલન કરવાની ક્ષમતા હોવી જોઈએ.

ગુમ થયેલ ઉપકરણો

જો કોઈપણ ઉપકરણો ગુમ થઈ જાય તો મતદાન પ્રક્રિયામાં વિક્ષેપને રોકવા માટે:

- જો કોઈ મત કેન્દ્રમાં સાધનો ગુમ થાય છે, તો મત કેન્દ્રની લીડ મુખ્ય ROV ઓફિસને જાણ કરશે.
- બેકઅપ ચૂંટણી ઉપકરણો સંગ્રહ કરતી મોબાઇલ સપ્લાય ટ્રકનું વ્યવસ્થાપન વેરહાઉસ સ્ટાફ દ્વારા કરવામાં આવશે.

- મત કેન્દ્ર પર પુરવઠા અને ઉપકરણોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા બે વેરહાઉસ સ્ટાફ સભ્યો સપ્લાય ટ્રકમાંથી મત કેન્દ્ર સુધી કોઈપણ પુરવઠા અને ઉપકરણો તૈનાત કરશે.

બેકઅપ મતદાન પુરવઠો

કોઈપણ મતદાન પુરવઠો બિનઉપયોગી થઈ જાય અથવા ગુમ થઈ જાય તો મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ અટકાવવા માટે:

- મત કેન્દ્રના કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવેલ કન્ટેનરની ડુપ્લિકેટ જાળવવામાં આવશે.
- મત કેન્દ્રના સંયોજક બેકઅપ વોટિંગ પુરવઠાને જાળવવા માટે જવાબદાર છે.
- એવી ઘટનામાં કે જો કોઈ સ્થાન ખસેડવું પડે, અને કર્મચારીઓ તેમનો વર્તમાન પુરવઠો એકત્રિત કરવામાં સમર્થ ન હોય તો, જ્યારે શક્ય હોય ત્યારે બેકઅપ પુરવઠો નવા સ્થાન પર પહોંચાડવામાં આવશે.

મત કેન્દ્રના ગેરહાજર કર્મચારી

મત કેન્દ્રના કર્મચારીઓ તેમની નિયુક્ત પાળીમાં રિપોર્ટ ન કરે તો મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ અટકાવવા માટે:

- મત કેન્દ્રના લીડ મત કેન્દ્ર પર બદલીના કર્મચારીઓ પ્રાપ્ત કરવા માટે ROV ઓફિસનો સંપર્ક કરશે.
- પ્રશિક્ષિત બેકઅપ કર્મચારીઓની સૂચિ મુખ્ય ROV ઓફિસ દ્વારા જાળવવામાં આવશે.

શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ

કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ દેખાય તો મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ અટકાવવા માટે:

- મત કેન્દ્રના લીડ પરિસ્થિતિના આધારે સુરક્ષા અધિકારીઓનો સંપર્ક કરશે.

મેન્યુઅલ સિસ્ટમો તૈનાત

ઇલેક્ટ્રોનિક મતદાન ઉપકરણો બિનઉપયોગી થઈ જાય મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ અટકાવવા માટે:

- બધા કાર્યો મેન્યુઅલ પ્રક્રિયા દ્વારા કરી શકાય છે.